

પ્રશ્ન-૪: સાગર અને સરિતા ૨ : ૩ મુજબ નફો-નુકસાન વહેંચતા ભાગીદારો છે. તા. ૩૧-૩-૨૧૮ના રોજનું તેમનું પાકું સરવૈસું નીચે પ્રમાણે હતું. (૧૫)

| જવાબદારીઓ | રૂ. | મિલકતો | રૂ. |
|------------------|----------|------------|----------|
| મૂડી: | | પાઘડી | ૧૨,૫૦૦ |
| સાગર ૪૦,૦૦૦ | | મકાન | ૬૦,૦૦૦ |
| સરિતા ૫૦,૦૦૦ | ૯૦,૦૦૦ | ચંત્રો | ૧૧,૫૦૦ |
| સામાન્ય અનામત | ૫,૦૦૦ | રોકાણો | ૭,૫૦૦ |
| ૧૨%ની આકાશની લોન | ૨૫,૦૦૦ | દેવાદારો | ૩૫,૦૦૦ |
| લેણદારો | ૩૦,૦૦૦ | સ્ટોક | ૧૭,૫૦૦ |
| | | રોકડ-બેન્ક | ૬,૦૦૦ |
| | ૧,૫૦,૦૦૦ | | ૧,૫૦,૦૦૦ |

તા. ૧-૪-૨૦૧૮ના રોજ પેટીનું સંગમ લિ.માં રૂપાંતર કર્યું. શરતો અને અન્ય માહિતી નીચે પ્રમાણે છે.

- (૧) કંપનીએ પેટીની તમામ મિલકતો અને લેણદારો સ્વીકાર્યા.
 - (૨) પેટીની પાઘડીનું મૂલ્ય રૂ. ૪૦,૦૦૦ નક્કી થયું.
 - (૩) મકાન, ચંત્રો અને રોકાણોનું મૂલ્ય અનુક્રમે રૂ. ૭૫,૦૦૦, રૂ. ૧૨,૫૦૦ અને રૂ. ૧૦,૦૦૦ થયું. જયારે દેવાદારો ૧૦% ઘાતબાધ અનામતને આધિન લેવા.
 - (૪) અન્ય મિલકતો ચોપડા કિંમતે લેવી.
 - (૫) કંપનીએ ખરીદ કિંમત પેટે દરેક રૂ. ૧૦નો એવા ૫,૫૦૦ ઇક્વિટી શેર, રૂ. ૪૭,૫૦૦ના ડિબેન્ચર અને બાકીના રોકડા સૂકવ્યા.
 - (૬) સરિતા રોક વર્ષના ચટેલા વ્યાજ સાથે આકાશની લોન સૂકવવા સંમત થઈ.
 - (૭) પેટીએ વિસર્જન ખર્ચના રૂ. ૨,૦૦૦ સૂકવ્યા.
- ભાગીદારો શેર અને ડિબેન્ચર તેમના પ્રમાણમાં વહેંચશે.
- ઉપરની માહિતી પરથી નીચાના ખાતાઓ તૈયાર કરો.
- (૧) માલ મિલકત નિકાલ ખાતું, (૨) ભાગીદારોના મૂડી ખાતાં અને (૩) રોકડ-બેન્ક ખાતું.

અથવા

પ્રશ્ન-૪: (અ) રોક પેટીની મિલકતો અને દેવાં નીચે પ્રમાણે હતા. (૦૮)

| વિગત | રૂ. | વિગત | રૂ. |
|---------|--------|----------|--------|
| ચંત્રો | ૭૦,૦૦૦ | ફર્નિચર | ૬૦,૦૦૦ |
| સ્ટોક | ૨૦,૦૦૦ | દેવાદારો | ૨૪,૦૦૦ |
| લેણદારો | ૩૦,૦૦૦ | દેવીહૂડી | ૨૦,૦૦૦ |
| રોકડ | ૨૦,૦૦૦ | | |

ગોપી લિ. એ પેટીનો ધંધો ખરીદી લીધો. ગોપી લિ. એ ખરીદ કિંમત પેટે પેટીને દરેક રૂ. ૧૦નો એવા ૮,૦૦૦ ઇક્વિટી શેર, દરેક રૂ. ૧૦૦નો એવા ૬૦૦ ડિબેન્ચર અને રૂ. ૧૦,૦૦૦ રોકડા આપ્યા.

ખરીદ કિંમત અને પાઘડીની કિંમત ગણો.

(બ) ભાગીદારી પેટીનું કંપનીમાં રૂપાંતર સમયે ખરીદ કિંમતની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? વિસ્તારથી સમજાવો. (૦૭)